

અરજદારની ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ- ૪૮૭ અને ૫૦૩ મુજબની અરજી લગત હુકમ.

(૧) આ કામનાં અરજદારની અરજી તથા રજુ થયેલ પેપર્સ વંચાણે લીધા. પોલીસ અભિપ્રાય વંચાણે લીધો. જેમાં અરજદારના ખાતામાંથી ઉપડી ગયેલ રકમ તથા સાયબર સેલ દ્વારા ફીઝ કરેલ રકમની વિગત નીચે મુજબ છે.

ટેબલ -૧

નાણા ઉપડી ગયેલ અરજદારના ખાતાની વિગત

બેંકનું નામ	ખાતા નં.	ઉપડેલ રકમની વિગત
ICICI BANK	346701501951	Rs.337061.95/-

ટેબલ -૨

ફીઝ થયેલ ખાતા તથા નાણાની વિગત

બેંકનું નામ	ખાતા નં.	ફીઝ થયેલ રકમની વિગત
BANK OF BARODA (Including Vijaya Bank and Dena Bank)	57190100007917 IFSC :	Rs.7294/-
UCO BANK	08140110088197 IFSC :	Rs.29870/-
STATE BANK OF INDIA	41936050929 IFSC :	Rs.4000/-

(૨) હાલના અરજદારે તેઓની અરજીમાં રજુઆત કરેલ છે કે તેઓ અરજીમાં જણાવ્યા મુજબના સરનામે હાલમાં રહે છે તથા તેઓની સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ જે બનાવમાં તેઓનાં ઉપરોક્ત ટેબલ-૧માં જણાવ્યા મુજબની વિગતે નાણાં ઉપડી ગયેલ હતા. જે બાબતે તેઓએ ફરીયાદ નોંધાવેલ હતી. જે સબબ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સામાવાળાના ઉપરોક્ત ટેબલ-૨ માં જણાવ્યા મુજબની વિગતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ- ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ હતા જે હાલ સુધી સદર બેન્કમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. અરજદારે વધુમાં જણાવેલ છે કે આ બાબતે એફ.આઈ.આર થયેલ નથી. તેઓને ખુબજ મોટું આર્થિક નુકશાન થયેલ હોય તથા તેઓને ગુજરાન ચલાવવા માટે સદર રૂપિયાની જરૂર હોય સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ- ૪૮૭ અને ૫૦૩ મુજબ યોગ્ય તે હુકમ થવા અરજ કરેલ છે.

(૩) સદરહું અરજી બાબતે પોલીસ અભિપ્રાય મંગાવતા ત.ક.અ.શ્રીએ જણાવેલ છે કે, હાલના અરજદાર સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ જેમાં અરજદારનાં એકાઉન્ટમાંથી અરજદારની અરજી મુજબનાં નાણાં ઉપડી ગયેલ હતા. જે બાબતે અરજદારે પોતાની ફરીયાદ નોંધાવેલ હતી. જે ફરીયાદ આધારે અરજદારના ખાતામાંથી ગયેલ નાણા પૈકી સામાવાળાનાં ઉપરોક્ત ખાતામાં તેઓના ગયેલ નાણા પૈકી ઉપરોક્ત ટેબલ-૨ માં જણાવ્યા મુજબના નાણાં ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ- ૧૦૬ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણા પાછા મેળવવા માટે અરજદારે આપ

નામદાર સાહેબની કોર્ટમાં અરજી કરેલ હોય અને તે સારુ તેઓનો અભિપ્રાય માગેલ છે. જે બાબતે તેઓએ જણાવેલ છે કે અરજદારના નાણા સામાવાળાના જે ખાતામાં ગયેલ તે બેન્ક ખાતા બનાવટી હોવાનું તપાસમા જાણવા મળેલ છે તથા સદરહુ ખાતુ સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતુ સીઝ કર્યા બાબતે તેઓ (પોલીસ) સમક્ષ કોઈ પાંધા તકરાર લીધેલ નથી જેથી તે રુપીયા અરજદારને પરત આપવા તેઓનો અભિપ્રાય થાય છે.

(જ) આમ, ઉપર ચર્ચા કર્યા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજુ દસ્તાવેજો ધ્યાને લેતા સદર નાણા બેંક ખાતામા ફીઝ કરેલ હોય તેથી રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી તેમજ ભવિષ્યમા પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા સુંદરભાઈ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩ (૧) જી.એલ.એચ.પાના નંબર ૩૦૭ ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતા પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોય ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

-:: હુકમ ::-

- અરજદાર કલસરીયા જાગૃતિ અરવિંદભાઈનાઓની અરજી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ- ૪૯૭ અને ૫૦૩ અન્વયે આથી મંજૂર કરવામાં આવે છે.
- અરજદારને સદર ગુનાના કામે ફીઝ કરવામાં આવેલ ઉપરોક્ત પેરા નં. ૧ના ટેબલ- ૨ માં જણાવ્યા મુજબના નાણા દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલીજ રકમના સધ્ધર જામીન સંબંધિત પોલીસ સ્ટેશનમાં આપેથી નીચેની શરતોને આધીન વચગાળાની કસ્ટડી સ્વરૂપે પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.

શરતો-

- (૧) અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે અરજદારે આ નાણા અત્રેની અદાલત મા જમા કરાવવાના રહેશે.
- (૨) ઉપરોક્ત ખાતાધારક વ્યક્તિ કે અન્ય કોઈ વ્યક્તિ સદર નાણા પર કલેઈમ કરે અને પોતાનો હક/હિત પુરવાર કરે તેવા સંજોગોમાં અરજદારે સદર રકમ તાત્કાલીક પરત કરવાની રહેશે.
- (૩) અરજદારે સદર મુદ્દામાલ રકમનો કોઈ ગુનાહીત કામે ઉપયોગ કરવો/કરાવવો નહીં.
- (૪) કોઈ પણ શરતનો ભંગ થયેથી હાલનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે તથા બોન્ડ અને જામીનગીરીની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.
- વધુમાં હુકમ કરવામાં આવે છે કે, અરજદાર દ્વારા હુકમ મુજબના જાત જામીન(બોન્ડ) તથા સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેથી પોલીસ અધિકારીએ તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ જે તે બેન્કને કરવી તેમજ સંબંધિત બેન્ક ને હુકમ કરવામાં આવે છે કે, તેઓને પોલીસ અધિકારી દ્વારા અરજદારે હુકમ મુજબના જાત જામીન(બોન્ડ) તથા સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેલ હોવાની તથા આ હુકમની જાણ કર્યેથી દિન-૭ માં તેઓની ઉપરોક્ત પેરા નં. ૧માં ટેબલ નં- ૨ ની કોલમ-૧ માં જણાવેલ બેંકનાઓએ અરજદારના OTHERS ના ખાતા નં.002101001012329 IFSC :

ICIC00NIDHI માં જમા/ટ્રાન્સફર કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા સંબંધીત પોલીસ સ્ટેશનને બીનચુક કરવી.
આ હુકમ આજરોજ પુછી અદાલતમાં વાંચી, સંભળાવી જાહેર કર્યો.

તા. ૧૨/૦૫/ ૨૦૨૫
મુ.અમદાવાદ.

(શકિતસિંહ ઘનશ્યામભાઈ ચાંચુ)
૨૦માં એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ,
અમદાવાદ સીટી.
CODE NO. GJ00885